

સવારે યા સાંજે અકિલા ન્યુઝ .કોમ

તા. 13 જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૧૨ શનિવાર



મુખ્ય સમાચાર

News of Friday, 12th January 2018

ચીફ જસ્ટીસ સામે સવાલ ઉઠાવનાર ચાર જજોને ઓળખો...

ત્રણ તલાકનો ફેસલો આ પંચ પરમેશ્વરે સંભળાવ્યો હતો: ચીફ જસ્ટીસ દિપક મિશ્રા ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે જજને કહેવું પડ્યું, 'ભગવાન કે લીયે એસા ન કહે'



નવી દિલ્હી તા.૧૨ : સુપ્રિમ કોર્ટના સીનીયર જજોએ ઇતિહાસમાં પહેલી વખત દેશમાં સામે આવી સર્વોચ્ચ ન્યાયાલયમાં ચાલી રહેલી અનિયમિતતાઓ પત્રકારો સમક્ષ મુકી છે. આ જજોમાં જસ્ટીસ જે.ચેલમેશ્વર, જસ્ટીસ રંજન ગોગોય, જસ્ટીસ મદન લોકુર અને જસ્ટીસ કુરીયન જોસેફ સામેલ છે.

જસ્ટીસ જે.ચેલમેશ્વર

આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ૨૩ જુલાઈ ૧૯૫૩માં જન્મેલા જસ્ટીસ જસ્ટી ચેલમેશ્વરએ દ.ભારતની પ્રતિષ્ઠિત મદ્રાસ લોયલા કોલેજમાં ભૌતિકશાસ્ત્ર વિષય ઉપર સ્નાતક ડીગ્રી મેળવી હતી ત્યારબાદ આંધ્ર વિશ્વ વિદ્યાલયમાંથી ૧૯૭૬માં કાનૂની અભ્યાસ પુરો કર્યો ત્યારબાદ ૧૩ ઓક્ટોબર ૧૯૯૫માં ચેલમેશ્વર એડવોકેટ જનરલ બન્યા. પાછળથી ગુવાહાટી હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશની ભુમિકા પુરી કરી ૨૦૧૧માં સુપ્રિમ કોર્ટના જજ બન્યા.

જસ્ટીસ રંજન ગોગોય

૧૮મી નવેમ્બર ૧૯૫૪માં જન્મેલા જસ્ટીસ રંજન ગોગોય ૧૯૭૮માં વકીલ બન્યા. ગુવાહાટી હાઇકોર્ટમાં લાંબા સમય સુધી વકીલાત કર્યા પછી ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૧ના તેઓ ગુવાહાટી હાઇકોર્ટમાં કાયમી જજ તરીકે નિયુક્તિ પામ્યા. ત્યારબાદ ૯ સપ્ટેમ્બર ૨૦૧૦માં તેમની બદલી પંજાબ-હરીયાણા હાઇકોર્ટમાં થઈ. ૨૩ એપ્રિલ ૨૦૧૨ના તેઓ સુપ્રિમ કોર્ટમાં જજ બન્યા. રંજન ગોગોય સુપ્રિમ કોર્ટની એ બેન્ચમાં સામેલ હતા જેણે સુપ્રિમ કોર્ટના પુર્વ ન્યાયધીશ માર્કેન્ડેય કાત્તુને સોમિયા મર્ડર કેસ ઉપર બ્લોગ લખવા બાબતે અંગત રીતે અદાલતમાં રજુ થવાનો હુકમ કર્યો હતો.

જસ્ટીસ મદન ભીમરાવ લોકુર

જસ્ટીસ મદન ભીમરાવ લોકુરનો જન્મ ૩૧ ડિસે. ૧૯૫૩ના થયો હતો. તેઓએ દિલ્હીની મોડન સ્કુલમાં અભ્યાસ કર્યો અને દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ઇતિહાસ વિષય ઉપર સ્નાતક ડીગ્રી મેળવ્યા બાદ દિલ્હી યુનિ.માંથી જ ૧૯૭૭માં એલએલબીની ડીગ્રી મેળવી તેમણે દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં વકીલાત પણ કરી. ૧૯૮૧માં તેઓ પરીક્ષા પાસ કરી સુપ્રિમ કોર્ટમાં 'એડવોકેટ ઓન રેકોર્ડ' સ્થાપિત થયા. તેમણે સિવિલ ડિમીનલ કોન્સ્ટીટ્યુશનલ લો અને રેવન્યુ એન્ડ સર્વિસ લોમાં વિશેષતા મેળવી છે. ૧૯૯૦ થી ૧૯૯૬ સુધી તેઓ કેન્દ્ર સરકારના વકતા રહ્યા અને કેન્દ્ર સરકાર વતી તમામ કેસોની દલીલો કરી. તેમને ૪ જુન ૨૦૧૨ના સુપ્રિમ કોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યા.

જસ્ટીસ કુરીચન

જસ્ટીસ કુરીચનનો જન્મ ૩૦ નવેમ્બર ૧૯૫૩ના રોજ કેરળમાં થયો હતો. તેમણે કેરળ લો એકેડેમી લો કોલેજ, તિરૂવન્તપુરમમાંથી કાનૂની અભ્યાસ કર્યો હતો. ૧૯૭૭-૭૮માં તેઓ કેરળ યુનિવર્સિટીમાં એકેડેમીક કાઉન્સિલ સભ્ય બન્યા. ૧૯૮૩ થી ૧૯૮૫ સુધી કોચી યુનિવર્સિટીના સેનેટ મેમ્બર રહ્યા. ૧૯૭૯માં કેરળ હાઇકોર્ટમાંથી વકીલાત શરૂ કરવાવાળા કુરીચન ૧૯૮૭માં સરકારી વકીલ બન્યા અને ૧૯૯૪ થી ૧૯૯૬ સુધી એડીશનલ જનરલ એડવોકેટ પદ ઉપર રહ્યા. ૧૯૯૬માં તેઓ સીનીયર વકીલ બન્યા અને ૧૨ જુલાઇ ૨૦૦૦ના કેરળ હાઇકોર્ટમાં જજ બન્યા. ૨૦૦૬ થી ૨૦૦૮ વચ્ચે તેઓ કેરળ ન્યાયીક એકેડેમીમાં અધ્યક્ષ રહ્યા. ૨૦૦૮માં તેઓ લક્ષ્યદ્વીપ લીગલ સર્વિસ ઓથોરીટીના અધ્યક્ષ બન્યા. ત્યારબાદ તેઓ ૮ ફેબ્રુઆરી ૨૦૧૦થી ૭મી માર્ચ ૨૦૧૩ સુધી ફિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ રહ્યા. ૮ માર્ચ ૨૦૧૩થી જસ્ટીસ કુરીચન સુપ્રિમ કોર્ટના જજ બન્યા. તેઓ ૨૯ નવેમ્બર ૨૦૧૮ના નિવૃત્ત થશે.

(4:03 pm IST)